

01 ઓગસ્ટ 2018

બ્રમ્પટન મ્યુનિસિપલ ચુંટણી માટેના ઉમેદવારોની અધિકૃત યાદી

બ્રમ્પટન, ઓન્ટારિયો – બ્રમ્પટનની 2018 મ્યુનિસિપલ ચુંટણી માટેના નામાંકનોનું સમાપન ગત સપ્તાહે જુલાઈ 27ના રોજ થયું.

સીટી ક્લર્ક દ્વારા પ્રમાણિત હોય એવી ઉમેદવારોની અધિકૃત યાદી [City's website www.brampton.ca/bramptonvotes](http://www.brampton.ca/bramptonvotes) પર ઉપલબ્ધ છે.

બિનહરીફ ચુંટાયા

મ્યુનિસિપલ ઈલેક્શન્સ એક્ટ 1996 જણાવે છે કે જો નામાંકન દિન પછીના સોમવારે સાંજે 4 વાગ્યે જો કોઈ પણ હોદ્દા માટેના પ્રમાણભૂત ઉમેદવારો ચુંટાવાપાત્ર સંખ્યા સમાન અથવા તેના કરતા ઓછી હોય તો ક્લર્ક તાત્કાલિક ધોરણે જે તે ઉમેદવાર અથવા ઉમેદવારોને બિનહરીફ ચુંટાયેલ એટલેકે ઈલેક્ટેડ બાય અક્લેમેશન જાહેર કરશે. સીટી દ્વારા વોર્ડ 7, 8, 9 અને 10 માટે ડફરિન-પીલ કેથલિક ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડના ટ્રસ્ટીના હોદ્દા માટે એક માત્ર નામાંકન પ્રાપ્ત થયું હતું. આથી, સફળ થયેલ ઉમેદવાર શૉન ઝેવિઅર, બિનહરીફ ચુંટાયા ગણાય છે એટલેકે ઈલેક્ટેડ બાય અક્લેમેશન.

મુખ્ય મુદ્દાઓ

- 2018 મ્યુનિસિપલ ચુંટણી સોમવારે, 22 ઓક્ટોબર 2018ના રોજ હાથ ધરાશે. મતદાન કરવાનો સમય છે સવારે 10 થી સાંજે 8.
- આ ચુંટણીમાં નવું એ છે કે ચુંટણીના દિવસે બ્રમ્પટનના મતદાતાઓ પોતાના વોર્ડમાં કોઈ પણ સ્થળે મતદાન કરી શકશે.
- ઓક્ટોબર 2, 3, 4, 6, 9, 10, 11 અને 13ના રોજ એડવાન્સ વોટિંગ હાથ ધરાશે. સ્થળ અને સમયની માહિતી [અહીં મળશે](#).
- વિધેયક 5, સીટી ઓફ ટોરોન્ટો એક્ટ, 2006માં સુધારા કરવા માટેનો એક્ટ, મ્યુનિસિપલ એક્ટ 2001 અને મ્યુનિસિપલ ઈલેક્શન્સ એક્ટ, 1996 ની સહુ પ્રથમ પ્રસ્તુતિ 30 જુલાઈ 2018ના રોજ ઓન્ટારિયોની વિધાનસભામાં થઈ હતી. જો તે પસાર થાય તો વિધેયક, રિજન ઓફ પીલ ચેરની ચુંટણી સ્થગિત કરી દેશે. રિજન ઓફ પીલ ચેરના હોદ્દા વિશેની માહિતી માટે મુલાકાત લો રિજન ઓફ પીલ [વેબસાઈટ](#).
- ઉમેદવારોની ઝુંબેશો અથવા પ્લેટફોર્મ વિષયક પ્રશ્નો અને પૂછપરછો જે તે ઉમેદવારને સંબોધિત કરશે.
- તૃતીય પક્ષ જાહેરાતકર્તા નોંધણીઓ 19 ઓક્ટોબર 2018 સુધી ફાઈલ કરી શકાશે.

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેક્ટના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.